

# નવા ઉદ્યોગસાહસો રચવામાં નવીનતા લાવવા, તેમની વૃદ્ધિમાં VCPEની ભૂમિકા વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્ઝિટી વ્યવસાયો માટે ધિરાણનાં શ્રેષ્ઠ વિકલ્પ

**વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્ઝિટી (VCPE)** અસ્ક્યામતની અલગ કેટેગરી તરીકે વિકસી રહ્યા છે તથા ભારત જેવા વિકાસશીલ અર્થતતોમાં ક્રોપોરેટ પિરાણનો સંભવિત સ્રોત બની રહ્યો છે. VCPE પણિક ઇક્ઝિટી ઈશ્યુ, પ્રાઇવેટ લેસમેન્ટ અને એક્સ્ટર્નલ કમર્શિયલ બોરોડેંગ (ઈસીબી) જેવા ભંડોળ ઊભાં કરવાનાં પરંપરાગત સ્રોતોમાં પૂરક બની રહ્યાં છે. ભારતમાં નવા ઉદ્યોગસાહસો રચવામાં, તેમાં નવીનતા લાવવામાં અને તેમની વૃદ્ધિમાં VCPEની ભૂમિકાને ઓછી ન આંકી શકાય.

પ્રાઇવેટ ઇક્ઝિટી પર વર્ષ 2012માં પ્રકાશિત થયેલા ડેલોઇટ રિપોર્ટ મુજબ, 21મી સદીની શરૂઆત સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયોની કામગીરીઓમાં ઘણો વધારો થયો છે તથા દેશમાં વિવિધ સમગ્ર અને સૂક્ષ્મ આર્થિક પરિબળોની અસર હેઠળ આ વ્યવસાયો નવેસરથી પરિભાષિત થઈ રહ્યાં છે; જેનાં પરિણામે રોકાણનાં પ્રવાહમાં વધારો થયો છે.

VCPE રોકાણની વિશિષ્ટતા જોખમી સાહસોને ટેકો આપવાની છે, જે અને ફંડનાં પરંપરાગત સ્રોતોથી અલગ પાડે છે. દેશમાં વધુને વધુ VCPE રોકાણકારોને આકર્ષણ માટે કમશા: અનુકૂળ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે છેવટે ભારતની વૃદ્ધિનાં પ્રદાન કરે છે. સામાન્ય રીતે VCPE રોકાણકારો જે તે દેશોમાં અને અસ્ક્યામતનાં વર્ગોમાં મૂડીરોકાણની સલામતીનો વિચાર કરે છે. તેઓ મૂલ્યાનું સર્જન કરે અને વધારે વળતર આપવાની સંભવિતતા ધરાવતાં અસ્કાયમતોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

VCPE રોકાણનાં મૂલ્યાનાં સંદર્ભ સાથે વેન્ચર ઈંજિનિયર્સ ટેટા સ્ટ્રીચે છે કે, 1990થી 1999નાં સમયગાળા દરમિયાન 64 દેશોમાં ભારતનું સ્થાન 25મું હતું, જેમાં આગામી દાયકામાં 2000થી 2009 વચ્ચે સુધારો થયો હતો. આ ગાળામાં ભારતનું સ્થાન 90 દેશોમાં 13મું હતું. વર્ષ 2011માં રાજન અને દેશમુખનાં અભ્યાસ મુજબ, વર્ષ 2005થી 2009 દરમિયાન ટ્રેન્ડ વધારે પ્રોત્સાહનજનક હતો, જેમાં ભારતનું સ્થાન 77 દેશોમાં 10મું હતું. એટલે પ્રસ્તુત સંશોધન લેખમાં છેલ્લાં બે દાયકામાં 1998થી 2018 દરમિયાન ભારતમાં VCPE રોકાણનાં પ્રવાહનાં વિશ્લેષણનો પ્રયાસ કર્યો છે, જે દેશમાં આર્થિક વાતાવરણ અને ઉપભોક્તાની પેટર્ન મુજબ ભારતની વ્યાવસાયિક દુનિયામાં



**સ્ટાર્ટઅપ ટોડો**  
**ડૉ. નિરાલી પટીત**

અસ્ક્યામતનાં આ નવા વળોની અનુકૂળતા અને સ્વીકાર્યતા પ્રતિબિંબિત કરે છે. ભારતીય VCPE ઉદ્યોગનાં પ્રવાહોનું ભારીક વિશ્લેષણ ભારતમાં તમામ વિવિધ ઉદ્યોગોમાં VCPE રોકાણમાં વધારો VCPE કંપનીઓ અને તેમની પાસેથી નાશાકીય સહાય ઈચ્છિતાં ભારતીય વ્યાવસાયિક ગૃહો અને બંને માટે વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

છેલ્લાં 20 વર્ષ (1998થી 2018)માં VCPE રોકાણની વૃદ્ધિની ગતિ રોકાણ થયેલી રૂકમ અને સોદાઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો સૂચયે છે. તેમાં ભારતીય અને વિદેશી રોકાણકારો માટે સીક્વોરિટીઝ

એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા VC માટેની માર્ગદર્શિકાઓને ઔપચારિક સ્વરૂપ મળવાથી તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) નાં ક્ષેત્રમાં તેજી આવવાથી વર્ષ 1998થી વર્ષ 2000નાં પ્રારંભિક તબક્કામાં વૃદ્ધિ થઈ હતી. પણ વર્ષ 2000થી વર્ષ 2004 વચ્ચે VCPE રોકાણમાં વધારો થયો હતો, જે માટે અમેરિકામાં ડોટકોમ તેજીનો પરપોટો કૂટવાનું અને તેની ભારત સહિત અન્ય વિકાસશીલ દેશોનાં અર્થતતો પર થયેલી અસર મુખ્યત્વે જ્વાબદાર કારણો હતાં. આગળ જતા પણ આ સેક્ટર પર મહત્વની ભૂમિકા ભજવાઈ શકે છે.

(લેખિકા: એસોસિએટ ફેફટી, ઈનીઆઈઆઈ, અમદાવાદ છે)  
 nirali@ediindia.org